



Classification: Official

Publications approval reference: C1321

કોવિડ-19 રસી ઉપલબ્ધ છે અને ચેપી રોગોથી તમારું રક્ષણ કરવામાં આવે તે તમારો અધિકાર છે.

યુ.કે.માં કોવિડ-19 રસી દરેક જણ માટે મફત છે. આમાં સ્થળાંતર કરીને આવેલા તમામ લોકો એટલે કે માઈગ્રન્ટ્સનો સમાવેશ થઈ જાય છે.

યુ.કે.માં લાખો લોકોને તેમની કોવિડ-19 રસી મળી ચૂકી છે. તે સલામત છે અને તેમાં કોઈ પ્રાણીજન્ય કે નુક્સાનકારક પદાર્થો નાંખેલા નથી. કોવિડ-19થી મૃત્યુ કે ગંભીર બીમારી થતાં રોકવાનો તે સર્વોત્તમ રસ્તો છે.

કોવિડ-19 રસી મેળવવા માટે તમે જી.પી. પાસે નોંધાયેલા હોવા કે NHS નંબર હોવો જરૂરી નથી.

જો તમારી પાસે NHS નંબર ન હોય તો તમે તમારા સ્થાનિક જી.પી.ની સર્જરીનો સંપર્ક કરીને રસી લેવાનું ગોઠવી શકો છો અથવા કોવિડ-19 રસીકરણ કરતા વોક-ઈન સેન્ટર કે પોપ-અપ સેન્ટરમાં જઈ શકો છો.

જો તમારી પાસે NHS નંબર હોય, તો તમને જ્યારે તમારી રસી માટે બોલાવવામાં આવે ત્યારે, તમે તેમાં હાજરી આપો તેવું અમે પ્રોત્સાહન આપીએ છીએ.

તમારા માટે અને તમારી સાથે રહેતી કોઈ પણ વ્યક્તિ માટે શું સર્વોત્તમ છે તે નક્કી કરવામાં તમારી મદદ માટે, અમે તમને કોવિડ-19 રસી વિશે માહિતી આપીશું અને તમે આરોગ્ય કર્મચારીને તે વિશે પૂછી શકો છો.

તમને કોવિડ-19 રસી લેવાની ક્યારેય જબરજસ્તી કરવામાં નહિ આવે અને તેના લીધે તમારા અસાયલમ કે રેફ્યુજી સ્ટેટસ પર કોઈ અસર પડતી નથી.

કોવિડ-19 માટેનો ટેસ્ટ કરાવવા, સારવાર મેળવવા કે રસી લેવા માટે ઈમિગ્રેશનની કોઈ તપાસ કરવામાં આવતી નથી.

કોવિડ-19 સામે સર્વોત્તમ રક્ષણ મેળવવા માટે સામાન્ય રીતે તમારે કોવિડ-19 રસીના બે ડોઝ લેવાના રહેશે.

તમને એકવાર રસી મળી જાય તે પછી તમને તમારી રસી વિશે માહિતી આપતું એક કાર્ડ આપવામાં આવશે, તમારી બીજી રસી માટે જાવ ત્યારે બને તો આ કાર્ડ સાથે લઈને જશો. જો તમને આ કાર્ડ આપવામાં ન આવ્યું હોય, તો કૃપા કરીને માંગી લો.

તમે કોવિડ-19 રસી વિશે અંગ્રેજીમાં અને બીજી ભાષાઓમાં અહીંથી વાંચી શકો છો:

- [COVID-19 guide for older adults](#)
- [NHS England COVID-19 vaccination communication materials](#)
- [COVID-19 vaccination for women of childbearing age, pregnant, planning a pregnancy or breastfeeding](#)
- [COVID-19 easy read resources](#)
- [Doctors of the World UK COVID-19 vaccination information](#)

હું જી.પી. પાસે નામ નોંધાવી શકું?

યુ.કે.માં કોઈ પણ વ્યક્તિ જી.પી. પાસે નામ નોંધાવી શકે છે. તમારા જી.પી. તમને આરોગ્ય સંભાળની સેવાઓ મેળવવામાં મદદ કરી શકે છે.

તમારી પાસે તમારા સરનામાનો અથવા ઓળખનો પુરાવો માગવામાં આવી શકે.

જો તમારી પાસે તમારા સરનામાનો કે ઓળખનો પુરાવો ન હોય, તો તેમને કહો કે તમારી પાસે નથી. તમે હજુ પણ જી.પી. પાસે નામ નોંધાવી શકો છો.

જો તમારી પાસે સરનામાનો અને ઓળખનો પુરાવો હોય તો બની શકે તો તે તેમને આપો.

તમારા ડોક્ટર પાસે તમારા વિશે અને તમારા આરોગ્ય વિશે જે માહિતી છે તે ખાનગી રહે છે.

જો ઉપયોગી લાગે, તો તમે જી.પી. પાસે નામ નોંધાવવા જાવ ત્યારે તેમને આ પત્ર બતાવી શકો છો.

જી.પી. શોધવા કે નામ નોંધાવવા માટે વધારે મદદ માટે, તમારા હાઉસિંગ વર્કર સાથે વાત કરો અથવા 0300 311 2233 પર ફોન કરો. તમને વધુ માહિતી અહીંથી મળી શકશે [NHS website](#) અને [GP access cards](#).

આપની સહાયથી



Dr Nikki Kanani
Deputy SRO, COVID-19 Vaccination
Deployment Programme
Medical Director of Primary Care
NHS England and NHS Improvement

This letter is translated into Gujarati.

This letter is also available in English and translated into Arabic, Bengali, Brazilian Portuguese, Bulgarian, Chinese, Czech, Estonian, Farsi, Greek, Hindi, Latvian, Lithuanian, Punjabi, Polish, Romanian, Romani, Russian, Spanish, Somali, Turkish, Twi, Ukrainian and Urdu.